

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા
“શાકભાજી અને મકાઈના પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ” અંગેની એક દિવસીય કેન્દ્રીય
ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે “સ્ટ્રેન્ધનીંગ ઓફ એગ્રી. પોલીકલીનીક ફોર ટ્રાયબલ ફામર્સ એટ દાહોદ”ની યોજના અંતર્ગત તા.૦૨.૦૮.૨૦૧૭ ના રોજ “શાકભાજી અને મકાઈના પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ” અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ” યોજવામાં આવેલ હતો. કેન્દ્રીય તાલીમ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ખરેડી તેમજ ધામરડા ગામના કુલ ૫૦ ખેડૂતભાઈઓ તથા બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓ એ ઉલ્લાસભર ભાગ લીધો..

કાર્યક્રમની શરૂઆતમાં હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના ડૉ. એસ. એ. ચૌહાણ, (રિસર્ચ એસોસીએટ) એ પધારેલ ખેડૂતભાઈઓ તથા બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓનું શાબ્દિકથી સ્વાગત કર્યું હતું તથા કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણ વિશે ખેડૂતોને જાણકારી આપી હતી. વધુમાં તેઓશ્રી દ્વારા એગ્રી. પોલીકલીનીક યોજનાની ઉપયોગીતા, કેન્દ્રીય તાલીમ કાર્યક્રમ, ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમ, રોગ-જીવાતનું નિદાન, જમીન પુથ્થકરણ, સુધારેલી જાતોની પસંદગી વિશે ઉંડાણમાં માર્ગદર્શન આપેલ. ત્યારબાદ ખેડૂતભાઈઓ તથા બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ જુદા જુદા વિષય નિષ્ણાતો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન તેમજ મોબાઈલ એપ્લીકેશન “i-khedut અને i-kisan” વિશે જાણકારી આપેલ.

ડૉ. એસ. એ. ચૌહાણ, (રિસર્ચ એસોસીએટ) દ્વારા શાકભાજી અને મકાઈના પાકની નફાકારક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી અંગે ખેડૂતભાઈઓ તથા બહેનોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) “શાકભાજી અને મકાઈના પાકની વિવિધ જાતો તેમજ બીજ ઉત્પાદન” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપેલ હતું.

ભોજન વિરામબાદ શ્રી એમ. પી. રામાણી, (ખેતી અધિકારી) અસરકારક નિંદામણ નિયંત્રણ તેમજ કાર્યક્ષમ માત્રામાં રાસાયણિક ખાતર વપરાશની ઉપયોગીતાથી માહિતગાર કર્યા હતા. શ્રી આરિફ શેખ (રિસર્ચ એસોસીએટ) દ્વારા શાકભાજી અને મકાઈના પાકમાં આવતા અગત્યના રોગ-જીવાતના નિયંત્રણ વિશે, કૃષિ પાકોમાં બાયોફર્ટીલાઈઝરની ઉપયોગીતા તેમજ દાહોદ જિલ્લાના મુખ્ય પાકોમાં જીવાત નિયંત્રણના વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતું. ત્યાર બાદ કુ. શીતલ પારગી (ખેતી અધિકારી) અને શ્રી આરિફ શેખ (રિસર્ચ એસોસીએટ) એ પધારેલ ખેડૂતભાઈઓ તથા બહેનોને હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર હસ્તકના મ્યુઝીયમ તથા સંશોધન કેન્દ્રની

મુલાકાત કરાવેલ હતી. સદર કાર્યક્રમનું આયોજન તેમજ સફળ સંચાલન ડૉ. એમ. એમ. પંડ્યા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) દ્વારા કરવામાં આવેલ હતું.

શ્રી આરીફ શેખ (રિસર્ચ એસોસીએટ) દ્વારા પધારેલ ખેડૂતભાઈઓ તથા બહેનો, કૃષિ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને આભારવ્યકત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

ફોટોગ્રાફ

		
<p>રજીસ્ટ્રેશન</p>	<p>શાબ્દિક સ્વાગત</p>	<p>દીપ પ્રાગટ્ય</p>
		
<p>“શાકભાજી અને મકાઈના પાકની વિવિધ જાતો તેમજ બીજ ઉત્પાદન” વિશે માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડ્યા</p>	<p>“શાકભાજી અને મકાઈના પાકની નફાકારક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી તેમજ મોબાઈલ એપ્લીકેશન” વિશે માહિતી આપતા ડૉ. એસ. એ. ચૌહાણ</p>	<p>“નિંદણ નિયંત્રણ અને રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ” વિશે વ્યાખ્યાન આપતા શ્રી એમ. પી. રામાણી</p>



ખેડૂતભાઈઓ તથા બહેનો દ્વારા પ્રશ્નોતરીના ઉત્તર આપતા વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડયા



“હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર” હસ્તકના મ્યુઝીયમની મુલાકાત



ખેડૂતભાઈઓ તથા બહેનોને “હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર” હસ્તકના મ્યુઝીયમની મુલાકાત તેમજ મકાઈ, સોયાબીન તેમજ નાગલીના પાકોની જાતો વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડયા



મકાઈની વિવિધ જાતો વિશે ખેડૂતભાઈઓ તથા બહેનોને પ્રત્યક્ષ માહિતી આપતા વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડયા અને ડૉ. એસ. એ. ચૌહાણ